



**NBH-1601270101020301** Seat No. \_\_\_\_\_

**B. A. (Sem. II) (CBCS) Examination**

**April / May – 2017**

**Psychology : Paper - I**

*(Basic Psychological Processes-II)*

*(Core)*

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

- ૧ શિક્ષણ એટલે શું ? પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત ચર્ચો. ૧૪  
અથવા
- ૧ પ્રેરણાની વ્યાખ્યા આપી, શારીરિક પ્રેરણાઓ જણાવો. ૧૪
- ૨ માનસિક સ્વાસ્થ્ય એટલે શું ? માનસિક સ્વાસ્થ્યને જોખમાવનારાં ઘટકો સમજાવો. ૧૪  
અથવા
- ૨ સ્મૃતિનો અર્થ આપી, તેનાં સોપાનો જણાવો. ૧૪
- ૩ વ્યક્તિત્વ એટલે શું ? તેને અસર કરતાં ઘટકો સમજાવો. ૧૪  
અથવા
- ૩ અસરકારક માનવસંબંધના સિદ્ધાંતો વર્ણવો. ૧૪
- ૪ પાવલોવનો અભિસંધાનનો સિદ્ધાંત વિસ્તૃત વર્ણવો. ૧૪  
અથવા
- ૪ યુંગના વ્યક્તિત્વના પ્રકારો જણાવો. ૧૪
- ૫ ટૂંક નોંધ લખો : (કોઈ પણ બે) ૧૪  
(૧) શિક્ષણને અસર કરતાં ઘટકો  
(૨) સામાજિક પ્રેરણાઓ  
(૩) વિસ્મરણના નિર્ણાયકો  
(૪) કેવા પ્રકારના લોકો આપણને ગમે છે ?

## ENGLISH VERSION

- 1 What is learning ? Discuss its trial and error theory. 14
- OR**
- 1 Definition of motivation. Explain the physiological motivation. 14
- 2 What is mental health ? Explain the damaging factors of mental health. 14
- OR**
- 2 Give the definition of memory and explain its stages. 14
- 3 What is personality ? Explain the affecting factor of personality. 14
- OR**
- 3 Narrate Theory of effective relationship in human being. 14
- 4 Narrate in detail the Pavlov's theory of conditioning. 14
- OR**
- 4 Explain the types of personality by Young. 14
- 5 Write short notes : (any two) 14
- (1) Effective variable of learning process.
  - (2) Social motivations
  - (3) Determinant of forgetting
  - (4) What types of people we like ?